



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ-૦૧

તા.૩૦.૦૧.૨૦૧૮

જનતા જનાર્દનના આશીર્વાદથી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે- શ્રી જીતુભાઈ વાઘાણી

કોંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચારનું સાધન જ્યારે ભાજપ માટે સત્તા એ સેવા માટેનું માધ્યમ છે  
- શ્રી જીતુભાઈ વાઘાણી

ભાજપાની પ્રામાણિક અને વિકાસલક્ષી શાસનવ્યવસ્થાને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થયા છે.

ગુજરાતમાં સતત ત્રણ દાયકાથી હારનાર કોંગ્રેસ વાસ્તવિકતાથી દૂર “મુંગેરીલાલ કે હસીન સપને”ની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઈ રહી છે

ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જનતા જનાર્દનના આશીર્વાદથી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ભાજપાની પ્રામાણિક અને વિકાસલક્ષી શાસનવ્યવસ્થાને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થયા છે. તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠીવાર પ્રજાએ ભાજપાની વિકાસલક્ષી રાજનીતિ પર મહોર મારી છે.

શ્રી વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ૧૯૮૫ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ગામડાઓ તથા નગરોની હાલત અત્યંત દયનીય હતી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામડાઓ તથા નગરોમાં પીવાના પાણી, રોડ-રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ શા માટે ઉપલબ્ધ નહોતી ? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની અબજો રૂપિયાની ગ્રાન્ટ કોંગ્રેસના શાસનમાં ક્યાં જતી રહેતી ? તેનો જવાબ કોંગ્રેસ આપે.



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

//૨//

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સતત ત્રણ દાયકાથી હાર થઈ છે, ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી, કોંગ્રેસ તેનો જનાધાર ખોઈ બેઠી છે છતાં, કોંગ્રેસ વાસ્તવિકતાથી દૂર “મુંગેરીલાલ કે હસીન સપને”ની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઈ રહી છે. કોંગ્રેસ જ્યારે-જ્યારે સત્તા પર આવી છે ત્યારે, ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કોંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચારનું સાધન જ્યારે ભાજપા માટે સત્તા એ સેવા માટેનું માધ્યમ છે. કોંગ્રેસના જુદાણાઓ અને ઠાલા વચનોને ગુજરાતની જનતા સુપેરે ઓળખે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “શહેરી વિકાસ વર્ષ” અંતર્ગત ગુજરાતના નાના નગરોના વિકાસ માટેના કાર્યો હાથ ધરાયા હતા. ભાજપાના ૨૨ વર્ષના સુશાસનમાં ગુજરાતના ગામડા સમૃદ્ધ તથા સુવિધાસભર બન્યા છે. આપણે ગ્રામ સડક યોજના થકી દરેક ગામને શહેરો સાથે જોડવામાં સફળ રહ્યા છીએ. જ્યોતિગ્રામ યોજના થકી ગામોમાં પણ ૨૪ કલાક વીજળી પૂરી પાડી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે, “ગામડું એ દેશની આત્મા છે”, ત્યારે ગ્રામ્ય વિકાસ થકી રાજ્ય અને દેશનો વિકાસ કરવો એ ભાજપાની પ્રાથમિકતા રહી છે. દેશના નગરોમાં માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજના અંતર્ગત ગુજરાતના એક લાખથી વધુ વસ્તી ધરાવતાં ૩૧ નગરોની પસંદગી કરાઈ છે. જે અંતર્ગત રૂપિયા ૪,૫૫૩ કરોડના માળખાગત સવલતોના કામો હાથ ધરવામાં આવ્યા છે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની નગરપાલિકાઓ તેમજ ગામડાઓ આધુનિક માળખાકિય સુવિધાસભર બને તે માટેની અનેક યોજનાઓ કાર્યાન્વિત છે. તમામ નગરપાલિકાઓમાં સી.સી.રોડ, ભૂગર્ભ ગટર યોજના અને ઘરે-ઘરે નળ દ્વારા પીવાના શુદ્ધ પાણીની સુવિધા તેમજ ચિલ્ડ્રન પાર્ક, તળાવોનું બ્યુટીફિકેશન વગેરે જેવા વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા વિભાગ



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ-૦૨

તા.૩૦.૦૧.૨૦૧૮

## નગરપાલિકાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસના અગ્રણીઓ ભાજપામાં જોડાયા

પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આજરોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસ અમદાવાદ જિલ્લાના મહામંત્રી મેરૂભા ગોહિલ, સાણંદ નગરપાલિકાના સભ્ય ઘનશ્યામસિંહ વાઘેલા અને કરમસીભાઈ રબારી સહિત કોંગ્રેસના દિગ્વિજયસિંહ ગોહિલ, મેઘરાજસિંહ ગોહિલ કાર્યકર્તાઓ સાથે ભાજપામાં જોડાયા હતા.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપાનો ખેસ પહેરાવીને સૌને આવકાર્યા હતા. મહામંત્રી સર્વેશ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અમદાવાદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા વિભાગ